

PHYSICAL EDUCATION

PAPER - II

Signature of Invigilators

Roll No.
(In figures as in Admit Card)

1.

2.

JY-06/21

Roll No.
.....
.....
(in words)

Name of the Areas/Section (if any).....

(in words)

Time Allowed : 75 Minutes]

[Maximum Marks : 100

Instructions for the Candidates

1. Write your Roll Number in the space provided on the top of this page.
2. This paper consists of fifty (50) multiple choice type questions. All questions are compulsory.
3. Each item has upto four alternative responses marked (A), (B), (C) and (D). The answer should be a capital letter for the selected option. The answer letter should entirely be contained within the corresponding square.
Correct method **A** Wrong method **A** OR **A**
4. Your responses to the items for this paper are to be indicated on the ICR Answer Sheet under Paper II only.
5. Read instructions given inside carefully.
6. Extra sheet is attached at the end of the booklet for rough work.
7. You should return the test booklet to the invigilator at the end of paper and should not carry any paper with you outside the examination hall.

પરીક્ષાર્થીઓ માટે સૂચનાઓ :

૧. આ પાનાની ટોચમાં દર્શાવેલી જગતમાં તમારો રોલ નંબર લખો.
૨. આ પ્રશ્નપત્રમાં કુલ ૫૦ (૫૦) બહુવૈકલ્પિક ઉત્તરો ધરાવતા પ્રશ્નો આપેલા છે. બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
૩. પ્રત્યેક પ્રશ્ન વધુમાં વધુ ચાર બહુવૈકલ્પિક ઉત્તરો ધરીવે છે. જે (A), (B), (C) and (D). વડે દર્શાવવામાં આવ્યા છે. પ્રશ્નનો ઉત્તર કેપીટલ સંજ્ઞા વડે આપવાનો રહેશે. ઉત્તરની સંજ્ઞા આપેલ જ્ઞાનમાં ખરાબર સમાઈ જાય તે રીતે લખવાની રહેશે.

ખરી રીત : **A** ખોટી રીત : **A** , **A**

૪. આ પ્રશ્નપત્રના જવાબ આપેલ ICR Answer Sheet ના Paper II વિભાગની નીચે આપેલ જ્ઞાનમાં આપવાના રહેશે.
૫. અંદર આપલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
૬. આ બુકલેટની પાછળ આપેલું પાનું ૨૩ કામ માટે છે.
૭. પરીક્ષા સમય પૂરો થઈ ગયા પછી આ બુકલેટ જે તે નિરીક્ષકને સોંપી દેવી. કોઈપણ કાગળ પરીક્ષા અંડની બહાર લઈ જવો નહીં.

PHYSICAL EDUCATION

PAPER - II

NOTE : This paper contains FIFTY (50) multiple-choice / Assertion & Reasoning/ Matching questions, each questions carrying two (02) marks. Attempt ALL the questions.

નોંધ : આ પ્રશ્નપત્રમાં ૫૦ (૫૦) બહુવિકલ્પીય પ્રશ્નો, સાચું-ખોટું અને જોડકાં બનાવવાના પ્રશ્નો છે. તમામ પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રત્યેક પ્રશ્નના બે (૨) મુદ્દા છે.

1. What is the aim of Physical Education ?
(A) Physical development
(B) Growth and development
(C) A whole some development of an individual
(D) All of the above.
2. The term 'Citius' in the Olympic motto denotes
(A) Higher
(B) Faster
(C) Stronger
(D) All of the above
3. Which of the following is NOT a spinal injury ?
(A) Fracture
(B) Dislocation
(C) Slipped Disc
(D) Laceration
4. Athlete's Foot is caused by
(A) Virus
(B) Bacteria
(C) Fungus
(D) None of the above.
૧. શારીરિક શિક્ષણનું ધ્યેય શું છે.
(A) શારીરિક વિકાસ
(B) વૃદ્ધિ અને વિકાસ
(C) વ્યક્તિનો સર્વોચ્ચ વિકાસ
(D) ઉપરના બધા.
૨. ઓલિમ્પિક સૂત્રમાં 'Citius'નો અર્થ -
(A) વધારે ઉંચાઈ
(B) વધારે ઝડપ
(C) વધારે મજબૂત
(D) ઉપરના બધા.
૩. નીચેનામાંથી કઈ ઈલા કરોડરજ્જુની નથી
(A) ફ્રેક્ચર
(B) ડિસલોકેશન
(C) સ્લીપડ ડિસ્ક
(D) લેસેરેશન.
૪. 'એથ્લેટ્સ ફૂટ' થવાનું કારણ
(A) વાયરસ
(B) બેક્ટેરિયા
(C) ફંગસ
(D) ઉપરનામાંથી કોઈ નહિં.

5. Muscles which cause bend in the joints are called
 (A) Flexors
 (B) Extensors
 (C) Abductors
 (D) Adductors
6. The path of an object projected in the air is known as
 (A) Speed
 (B) Abnormal Curve
 (C) Velocity
 (D) Parabola
7. Theory of conditioning was given by
 (A) Aritotle
 (B) Pavlov
 (C) Gestalt
 (D) Thorndike
8. The 'trial and error' theory of learning was propounded by
 (A) Newton
 (B) Pavlov
 (C) Thorn dike
 (D) Homer
9. Factors affect the time table
 (A) Number of students
 (B) Equipment available
 (C) Climate Conditions
 (D) All of the above
10. Total number of byes to be given when 21 teams are participating
 (A) 10
 (B) 11
 (C) 12
 (D) 13
૫. સાંધાને વાળવામાં કારણભૂત સ્નાયુ
 (A) ફ્લેક્સર
 (B) એક્સ્ટેન્સર
 (C) એબડક્ટર્સ
 (D) એડક્ટર્સ
૬. કોઈ પણ વસ્તુ હવામાં ફેંકવામાં આવે તો તે અંતરના માર્ગને કહે છે -
 (A) સ્પીડ
 (B) એબનોર્મલ કર્વ
 (C) વેલોસીટી
 (D) પેરાબોલા
૭. 'કન્ડીશનીંગ' થીયેરીના ઠાણા -
 (A) એરીસ્ટોટલ
 (B) પાવલોવ
 (C) ગેસ્ટાલ્ટ
 (D) થોરન્ડાઈક
૮. 'ટ્રાયલ અને એરર' સીખવાની થીયેરી પ્રસ્થાપિત કરનાર -
 (A) ન્યુટન
 (B) પાવલોવ
 (C) થોર્નડાઈક
 (D) હોમર
૯. સમય પત્રકને અસર કરનાર પરીબળ -
 (A) વિદ્યાર્થી સંખ્યા
 (B) સાધન સુવિધા
 (C) વાતાવરણ
 (D) ઉપરના બધા.
૧૦. ૨૧ ટુકડીઓ હરીફાઈ ભાગ લે ત્યારે કેટલી બાય (byes) આપવામાં આવશે -
 (A) ૧૦
 (B) ૧૧
 (C) ૧૨
 (D) ૧૩

11. An efficient coach is he who -
 (A) Tells
 (B) Tells and demonstrates
 (C) Tells, demonstrates and explains
 (D) Tells, demonstrates, explains and inspires.
12. Which of the following value can not be determined graphically ?
 (A) Mode
 (B) Mean
 (C) Median
 (D) Standard deviation
13. Sargent jump measures
 (A) Explosive leg strength
 (B) Agility
 (C) Explosive arm strength
 (D) Flexibility
14. Which of the following is a motor educability test ?
 (A) J.C.R. test
 (B) I.O.W.A. test
 (C) Fleisman test
 (D) None of the above.
15. Reliability denotes
 (A) Consistency of Performance
 (B) Variability among groups
 (C) Inconsistency among subjects
 (D) None of the above.
16. Sports management is -
 (A) An art
 (B) A science
 (C) Both A. and B.
 (D) None of the above.

૧૧. સક્ષમ શહુબર તેને કહેવાય જે -
 (A) માહિતી આપે
 (B) માહિતી આપે, અને નિદર્શન આપે
 (C) માહિતી આપે, નિદર્શન આપે અને સમજૂતિ આપે
 (D) માહિતી આપે, નિદર્શન આપે, સમજૂતિ આપે અને ઉત્તેજન આપે.
૧૨. નીચેનામાંથી કઈ કિંમત ગ્રાફ દ્વારા દર્શાવી શકાતી નથી.
 (A) બહુલક
 (B) મધ્યક
 (C) મધ્યસ્થ
 (D) પ્રમાણિત વિચલન
૧૩. 'સાર્જન્ટ જમ્પ' માપે છે.
 (A) પગની વિસ્ફોટક શક્તિ
 (B) ચપળતા
 (C) હાથની વિસ્ફોટક શક્તિ
 (D) નમનિયતા
૧૪. નીચેનામાંથી મોટર એજ્યુકેબીલીટી કસોટી કઈ છે ?
 (A) J.C.R. કસોટી
 (B) I.O.W.A. કસોટી
 (C) ફ્લેઈસ મેન કસોટી
 (D) ઉપરના કોઈ નહિં.
૧૫. વિશ્વસનિયતા દર્શાવે છે -
 (A) દેખાવની સુસંગતતા
 (B) જુથમાં વિવિધતા
 (C) વિષયોમાં અસુસંગતતા
 (D) ઉપરનામાં કોઈ નહિં.
૧૬. રમત વ્યવસ્થાપન છે -
 (A) કળા
 (B) વિજ્ઞાન
 (C) A અને B બંને
 (D) ઉપરનામાં કોઈ નહિં.

17. When was the YMCA (Chennai) college of Physical Education established?
 (A) 1914
 (B) 1896
 (C) 1920
 (D) 1924
18. Who inaugurated the first Modern Olympic games in 1896 ?
 (A) King George II of Greece
 (B) King George I of Greece
 (C) Mrs. Margaret Thatcher
 (D) B.P. Coubertin
19. Softness of bone is known as
 (A) Osteoporosis
 (B) Osteomalacia
 (C) Osteoblast
 (D) Osteoclast
20. Contrast bath is recommended for
 (A) Reducing dislocated joint pain
 (B) Reducing Swelling
 (C) Treatment of wound
 (D) None of the above.
21. On 'set' command the sprinter is in
 (A) Stable equilibrium
 (B) Unstable equilibrium
 (C) Neutral equilibrium
 (D) None of the above.
22. During abduction the arm moves
 (A) Towards the body
 (B) Away from the body
 (C) In front of the chest
 (D) None of the above.
૧૭. વાય. એમ. સી. એ. શારીરિક શિક્ષણ કોલેજ (ચેન્નાઈ)ની સ્થાપના ક્યારે થઈ.
 (A) ૧૯૧૪
 (B) ૧૮૯૬
 (C) ૧૯૨૦
 (D) ૧૯૨૪.
૧૮. ૧૮૯૬માં પ્રથમ આધુનિક ઓલિમ્પિક રમતોત્સવના ઉદ્ઘાટક -
 (A) ગ્રીસના કિંગ જ્યોર્જ -II
 (B) ગ્રીસના કિંગ જ્યોર્જ -I
 (C) મીસીસ માર્ગેટ થેચર
 (D) બી. પી. કુબેર્ટીન
૧૯. હાડકાની નરમાશ ઓળખાય છે -
 (A) ઓસ્ટીઓપોરીસીસ
 (B) ઓસ્ટીઓ માલાસીઆ
 (C) ઓસ્ટીઓ પ્લાસ્ટ
 (D) ઓસ્ટીઓ ક્લાસ્ટ
૨૦. કોન્ટ્રાસ્ટ બાથની ભલામણ કરવામાં આવે છે
 (A) સાંધાના ખસી જવાના દુખાવાને ઓછો કરવા.
 (B) સોળે ઓછો કરવા
 (C) ધા ની સારવાર
 (D) ઉપરમાંથી કોઈ નહિં.
૨૧. 'સેટ'ના હુકમ વખતે સ્પ્રીન્ટરની સ્થિતિ -
 (A) સ્થિર સમતોલન
 (B) અસ્થિર સમતોલન
 (C) તટસ્થ સમતોલન
 (D) ઉપરમાંથી કોઈ નહિં.
૨૨. એબડક્શન દરમ્યાન હાથનું હલનચલન
 (A) શરીર તરફ
 (B) શરીરથી દૂર
 (C) છાતીની આગળ
 (D) ઉપરમાંથી કોઈ નહિં.

23. Cognitive learning is also called
 (A) Mental learning
 (B) Affective learning
 (C) Motor learning
 (D) All of the above.

24. Personality study is a kind of
 (A) Historical Research
 (B) Experimental Research
 (C) Case Study
 (D) All of these

25. Research process consists of
 (A) Collection of data
 (B) Analysis of data
 (C) Drawing of inferences
 (D) All of these

26. The type of Research method used in the study of two variables is
 (A) Survey type
 (B) Historical type
 (C) Experimental type
 (D) Philosophical type

27. Who was the first principal of YMCA (Chennai) College of Physical Education?
 (A) C.A. Bucher
 (B) H.C. Buck
 (C) G.D. Sondhi
 (D) B.P. Coubertin

28. In which year NSNIS Patiala was established ?
 (A) 1998
 (B) 1959
 (C) 1960
 (D) 1961

૨૩. કેપીટીવ (જ્ઞાનપ્રધાન) અભ્યાસને કહેવામાં આવે છે.
 (A) માનસીક અધ્યયન
 (B) અસરકારક અધ્યયન
 (C) ગત્યાત્મક અધ્યયન
 (D) ઉપરના બધા.

૨૪. વ્યક્તિત્વ અભ્યાસનો પ્રકાર
 (A) ઐતિહાસીક સંશોધન
 (B) પ્રયોગાત્મક સંશોધન
 (C) વ્યક્તિ અભ્યાસ
 (D) ઉપરના બધા.

૨૫. સંશોધન પ્રક્રિયા બનેલી છે -
 (A) આંકડાનું એકત્રીકરણ
 (B) આંકડાનું પૃથક્કરણ
 (C) ડ્રોવીંગ ઈન્ફરન્સીસ
 (D) ઉપરના બધા

૨૬. દ્વિવિચલનના અભ્યાસ માટે સંશોધન પદ્ધતિનો પ્રકાર
 (A) સર્વેક્ષણ પ્રકાર
 (B) ઐતિહાસિક પ્રકાર
 (C) પ્રાયોગિક પ્રકાર
 (D) તત્ત્વજ્ઞાન પ્રકાર

૨૭. વાય.એમ.સી.એ. (ચેન્નાઈ) શારીરિક-શિક્ષણ કોલેજના પ્રથમ પ્રાચાર્ય -
 (A) સી.એ. બુચર
 (B) એચ.સી. બુક
 (C) જે.ડી સોંધી
 (D) બી.પી. કુબેરટીન

૨૮. એન.એસ.એન.આઈ.એસ. પતિયાળાનું સ્થાપના વર્ષ -
 (A) ૧૯૯૮
 (B) ૧૯૫૯
 (C) ૧૯૬૦
 (D) ૧૯૬૧

29. Which of the following is not a regional centre of SAI ?

- (A) Kolkata
- (B) Bangalore
- (C) Vadodara
- (D) Patiala

30. 'Fartlek' training is used to develop

- (A) Flexibility
- (B) Strength
- (C) Endurance
- (D) Neuro Muscular coordination

31. 'Micro Cycle' involves training of

- (A) One week
- (B) 6-8 weeks
- (C) 8-10 weeks
- (D) 1-2 weeks.

32. 'Stadiometer' is used to measure

- (A) Strength
- (B) Weight
- (C) Height
- (D) Circumference

33. Research proposal is also called

- (A) Abstract
- (B) Summary
- (C) Synopsis
- (D) Methodology

34. The most unreliable and unstable average is

- (A) Mode
- (B) Mean
- (C) Median
- (D) None of the above

૨૯. નીચેનામાંથી કયું SAI નું પ્રાદેશિક કેન્દ્ર નથી.

- (A) કલકત્તા
- (B) બેંગલોર
- (C) વડોદરા
- (D) પતિયાલા

૩૦. ફાર્ટલેક તાલિમના ઉપયોગ દ્વારા વિકાસ થાય છે. -

- (A) નમનિયતા
- (B) બળ
- (C) સહનશક્તિ
- (D) સ્નાયુ જ્ઞાનતંતુ ગતિસૂમેળ

૩૧. માઈક્રો સાયકલ તાલિમનો સમય

- (A) એક સપ્તાહ
- (B) ૬ થી ૮ સપ્તાહ
- (C) ૮ થી ૧૦ સપ્તાહ
- (D) ૧ થી ૨ સપ્તાહ

૩૨. સ્ટેડિયોમીટર દ્વારા માપી શકાય છે.

- (A) બળ
- (B) વજન
- (C) ઊંચાઈ
- (D) ઘેરાવો

૩૩. સંશોધન પ્રસ્તાવનાને કહે છે

- (A) એબસ્ટ્રેક્ટ
- (B) સમરી
- (C) સીનોપ્સીસ
- (D) મેથોડોલોજી

૩૪. અવિશ્વસનીય અને અસ્થિર સરેરાશ છે -

- (A) બહુલક
- (B) મધ્યક
- (C) મધ્યસ્થ
- (D) ઉપરમાંથી કોઈ નહિ.

35. A treadmill is used for measuring
- (A) Speed
(B) Power
(C) Work done in running
(D) Force.
35. Term 'Free Throw' is used in
- (A) Wrestling
(B) Football
(C) Volleyball
(D) Basketball
37. AAHPERD youth fitness test is used for measuring
- (A) General motor ability
(B) Motor fitness
(C) Motor educability
(D) All of the above.
38. Blue print of the competition plan is called
- (A) Technique
(B) Tactics
(C) Strategy
(D) Skill.
39. Which of the following is a method for the classification of pupil ?
- (A) Cozen method
(B) YMCA method
(C) Atlanta city method
(D) All of the above.
40. Which is the first step in a sports programme ?
- (A) Directing
(B) Staffing
(C) Planing
(D) Budgeting.

૩૫. ટ્રેડમીલના ઉપયોગ દ્વારા માપી શકાય છે.
- (A) સ્પીડ
(B) પાવર
(C) વર્ક ડન ઈન રનિંગ
(D) ફોર્સ
૩૬. 'ફ્રી થ્રો' શબ્દનો ઉપયોગ થાય છે.
- (A) કુસ્તી
(B) ફૂટબોલ
(C) વોલીબોલ
(D) બાસ્કેટબોલ
૩૭. AAHPERD યુથ ફિટનેસ ટેસ્ટ માપન કરે છે
- (A) જનરલ મોટર એબિલિટી
(B) મોટર ફિટનેસ
(C) મોટર એજ્યુકેબિલિટી
(D) ઉપરના બધા
૩૮. હરિકાઈ આયોજનની બ્લુપ્રિન્ટને કહેવામાં આવે છે -
- (A) ટેકનિક
(B) ટેકટીક્સ
(C) સ્ટ્રેટેજી
(D) સ્કીલ
૩૯. વિદ્યાર્થી વર્ગીકરણ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
- (A) કોઝન પદ્ધતિ
(B) વાય. એમ. સી. એ. ની પદ્ધતિ
(C) એટલાન્ટા સીટી પદ્ધતિ
(D) ઉપરના બધા
૪૦. રમત કાર્યક્રમમાં સૌથી પહેલું પગથિયું કયું છે ?
- (A) ડાયરેક્ટીંગ
(B) સ્ટાફિંગ
(C) પ્લાનીંગ
(D) બજેટીંગ

41. Maulana Abul Kalam Azad Trophy is awarded in Basketball -
 (A) True
 (B) False
 (C) Partly true
 (D) Partly false.
42. When 23 teams are participating eleven bye shall be given in first round in knowckout basis -
 (A) True
 (B) False
 (C) Partly true
 (D) Partly false
43. Haptethlon consists of Ten events in athletis
 (A) True
 (B) False
 (C) Partly true
 (D) Partly false
44. Winner team of Senior National Football Championship is awarded with Santosh Trophy
 (A) True
 (B) False
 (C) Partly true
 (D) Partly false
45. Make the correct choice from the Assertion (A) and Reason (R) given below:
 (A) Asking a good question, is the beginning of Research.
 (B) Interview is one of the tools for collecting Research data
 Select the correct answer from the codes given below
 (A) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)
 (B) Both (A) and (R) are true and (R) is not the correct explanation of (A)
 (C) (A) is true but (R) is false
 (D) (A) is false but (R) is true.
૪૧. મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી બાસ્કેટબોલ રમત માટે આપવામાં આવે છે
 (A) સાચું
 (B) ખોટું
 (C) આંશિક સાચું
 (D) આંશિક ખોટું
૪૨. ૨૩ ટુકડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હોય ત્યારે પ્રથમ રાઉન્ડમાં ૧૧ બાય આપવામાં આવે છે.
 (A) સાચું
 (B) ખોટું
 (C) આંશિક સાચું
 (D) આંશિક ખોટું
૪૩. 'હેપ્તાથલોન'માં ૧૦ રમત સમૂહનો સમાવેશ થાય છે.
 (A) સાચું
 (B) ખોટું
 (C) આંશિક સાચું
 (D) આંશિક ખોટું
૪૪. સીનીયર નેશનલ ફૂટબોલ વિજેતા ટુકડીને સંતોશ ટ્રોફી એનાયત કરવામાં આવે છે.
 (A) સાચું
 (B) ખોટું
 (C) આંશિક સાચું
 (D) આંશિક ખોટું

૪૫. નીચે આપેલ વિધાન અને તે માટે જણાવેલ કારણ માંથી સાચો વિકલ્પ શોધો :

વિધાન (A) સાચા પ્રશ્નો પુછવા એ સંશોધનની શરૂઆત છે.

(R) સંશોધનના પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ના સાધનોમાં ઈન્ટરવ્યુ પણ એક સાધન છે

નીચે આપેલ કોડમાંથી સાચો જવાબ શોધો.

(A) (A) અને (R) બંને સાચા છે. (R) એ (A) નું સાચું સ્પષ્ટીકરણ છે.

(B) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) નું સાચું સ્પષ્ટીકરણ નથી.

(C) (A) સાચુ છે પરંતુ (R) ખોટું છે.

(D) (A) ખોટું છે પરંતુ (R) સાચું છે.

46. Make the correct choice from the Assertion (A) and Reason (R) given below:

(A) Corrective physical education is also known as physical education rehabilitation

(B) Corrective exercise is beneficial for rehabilitation of injured Athlete.

Select the correct answer from the code given below :

(A) Both (A) and (R) are true and (R) is the correct explanation of (A)

(B) Both (A) and (R) are true and (R) is not the correct explanation of (A)

(C) (A) is true but (R) is false

(D) (A) is false but (R) is true.

૪૬. નીચે આપેલ વિધાન (A) અને તે માટે જણાવેલ કારણ (R) માંથી સાચો વિકલ્પ શોધો :

વિધાન (A) સુધારણા શારીરિક શિક્ષણને પુનઃસ્થાપિત શારીરિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

(R) ઈન્જરસ્ત ખેલાડી માટે સુધારણા કસરતો પુન સ્થાપિત માટે લાભકારક છે.

નીચે આપેલ કોડમાંથી સાચો જવાબ શોધો.

(A) (A) અને (R) બંને સાચા છે. (R) એ (A) નું સાચું સ્પષ્ટીકરણ છે.

(B) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) નું સાચું સ્પષ્ટીકરણ નથી.

(C) (A) સાચુ છે પરંતુ (R) ખોટું છે.

(D) (A) ખોટું છે પરંતુ (R) સાચું છે.

47. List I

- (a) Eden Garden Stadium
 (b) Wankhede Stadium
 (c) Feroz Shah Kotla Stadium
 (d) Maharaja Swami Man Singh Stadium

List II

- (1) Delhi
 (2) Jaipur
 (3) Kolkatta
 (4) Banglor
 (5) Mumbai

CODE	a	b	c	d
(A)	(3)	(4)	(2)	(1)
(B)	(4)	(5)	(1)	(2)
(C)	(3)	(5)	(1)	(2)
(D)	(3)	(5)	(1)	(4)

સૂચના : પ્રશ્ન નંબર ૪૭ થી ૫૦ ના જવાબો યાદિ - I અને યાદિ - II સાથે જોડી કોડમાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

૪૭. યાદિ - I

- (A) ઈડનગાર્ડન સ્ટેડિયમ
 (B) વાનખેડે સ્ટેડિયમ
 (C) ફિરોઝશા કોટલા
 (D) મહારાજા સ્વામી

યાદિ - II

- (1) દિલ્હી
 (2) જયપુર
 (3) કોલકત્તા સ્ટેડિયમ
 (4) બેંગલોરમાનસીંહ સ્ટેડિયમ
 (5) મુંબઈ

કોડ	a	b	c	d
(A)	(3)	(4)	(2)	(1)
(B)	(4)	(5)	(1)	(2)
(C)	(3)	(5)	(1)	(2)
(D)	(3)	(5)	(1)	(4)

48. List I

- (A) M.S. Dhoni
 (B) Naren Kartiken
 (C) Gopi Chand
 (D) Bhutia

List II

- (1) Badminton
 (2) Football
 (3) Cricket
 (4) Car driving
 (5) Golf

CODE	a	b	c	d
(A)	(3)	(4)	(1)	(2)
(B)	(3)	(4)	(1)	(5)
(C)	(4)	(3)	(1)	(5)

૪૮. યાદિ - I
- (A) એમ.એસ. ધોની
(B) નરેન કાર્તિકેન
(C) ગોપીચંદ
(D) ભુટિયા

- યાદિ - II
- (1) બેડમિન્ટન
(2) ફુટબોલ
(3) ક્રિકેટ
(4) કારકાર્ડવીંગ
(5) ગોલ્ફ

કોડ	a	b	c	d
(A)	(3)	(4)	(1)	(2)
(B)	(3)	(4)	(1)	(5)
(C)	(4)	(3)	(1)	(5)
(D)	(5)	(3)	(2)	(1)
(D)	(5)	(3)	(2)	(1)

49. List I

- (a) Kho-kho
(b) Kabaddi
(c) Basketball
(d) Volleyball

List II

- (1) Thigh Hold
(2) Smash
(3) 3-6-9 chain
(4) Shooting
(5) Putting

CODE	a	b	c	d
(A)	(1)	(2)	(3)	(4)
(B)	(3)	(1)	(4)	(2)
(C)	(1)	(3)	(4)	(5)
(D)	(3)	(1)	(4)	(5)

૪૯. યાદિ - I

- (A) ખોખો
(B) કબડ્ડી
(C) બાસ્કેટબોલ
(D) વોલીબોલ

યાદિ - II

- (1) થાય હોલ્ડ
(2) સ્મેશ
(3) ૩-૬-૯ ચેઇન
(4) શૂટીંગ
(5) પૂટીંગ

કોડ	a	b	c	d
(A)	(1)	(2)	(3)	(4)
(B)	(3)	(1)	(4)	(2)
(C)	(1)	(3)	(4)	(5)
(D)	(3)	(1)	(4)	(5)

50.

List I

- (a) Archery
- (b) Athletics
- (c) Badminton
- (d) Hockey

List II

- (1) Starting Block
- (2) Racket
- (3) Arrow
- (4) Bat
- (5) Stick

CODE	a	b	c	d
(A)	(3)	(1)	(2)	(5)
(B)	(3)	(1)	(2)	(4)
(C)	(1)	(2)	(3)	(4)
(D)	(5)	(1)	(2)	(3)

પા. ૫૦.

યાદિ - I

- (A) આર્ચરી
- (B) એથલેટીક્સ
- (C) બેડમિન્ટન
- (D) હોકી

યાદિ - II

- (1) સ્ટાર્ટિંગ બ્લોક
- (2) રેકેટ
- (3) એરો
- (4) બેટ
- (5) સ્ટીક

કોડ

	a	b	c	d
(A)	(3)	(1)	(2)	(5)
(B)	(3)	(1)	(2)	(4)
(C)	(1)	(2)	(3)	(4)
(D)	(5)	(1)	(2)	(3)

ROUGH WORK

ROUGH WORK